

વैद्य રાજલ દ્વારા

ઇષદ્ર એટલે થોડું અને ગોળ એટલે ગોળાકાર જે થોડું ગોળાકાર છે તેવું ઇષદ્રગોળ. ઇસબગુલ શાહી એટલો બધો ચલાણમાં છે કે જેને બદલી શકાય તેમ જણાતું નથી તેનો સાચો અર્થ કરવાને બધલે ઇસબગુલનો કોઈક અર્થ શોધવો પડશે. ઇષદ્રગોળ સિવાય તેને અંધગોળ, અંધકાર્ણ-બીજ, શીત બીજ, ઇશ્વરભોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપારિક સ્તર પર આની જેતી થાય છે અને અહીંથી જ હજારો ટન બીજા પ્રાંતોમાં તથા પરદેશ જાય છે.



ઇસબગુલ ખાવ અને તરોતાજ રહો

ઇષદ્રગોળને ગુજરાતીમાં ઓથમીજુદુ કહે છે. ઓથમીજુરાના ઘોડની ઊંચાઈ એક હાથ હોય છે. તેના પાન જીણા તથા લાંબા હોય છે. એ ઘોડ પર ઘઉંના જેવી ઉબીયો આવે છે. તેમાં જુરાના બી હોય છે. તેની ત્રણ જાત છે સકેદ, રાતી અને કાળી. આ ઓથમીજુરા પર સકેદ અધ્યપારદશક ફોટરી હોય છે તે છૂટી પડાય છે. તેને ઇષદ્રગોળ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ઇષદ્રગોળ મધુર, ડંડુ, પૌષ્ટિક છે. જાડો રોકનાર, લોપીના જાડા બંધ કરનાર, આફરો, ઉનવા, મોટાનાં ચાંદા, આમવિષમાં લાલઘઢ છે.

ઇષદ્રગોળ કબજિયાત પણ હૂર કરે છે. તે કક્ત યાંત્રિક રીતે જાડો લાવે છે. ઇષદ્રગોળ પર જઈ રસોની જરા પણ અસર થતી નથી. તે સીધું જ નાના આંતરડામાં ઉત્તે છે. તેની હાજરીમાં અન્નના પોષકતાત્ત્વોના શોષણમાં કોઈ જ ફેર થતો નથી. કારણ કે તે ફક્ત મળ ભાગને પોતાનામાં લેપેટીને આંતરડાની ગતિને વધારીને બહાર ઘેલી કાઢે છે. મોટા આંતરડામાં રહેલા જીવાણુઓની તેના પર અસર થતી નથી. તે અપચ્ય ગુદા વાટે બહાર નીકળી જાય છે અને ત્યાંની દિવાલોની શ્લેષ્મકલા ઉપર એક જાતનું અસ્તર બનાવી હોય છે! આંતરડાની દિવાલો પર ચાંદા હોય તેમાં આ ઇષદ્રગોળનો જે લુઅાબ છે તે ખૂબ જ કિમતી સાબિત થાય છે. મોટા આંતરડામાં રહેલ વિષાકત પદાર્થોને જાડા વાટે બહાર કાઢવા માટે ઇષદ્રગોળ જ શેષ છે.

પ્લાનટાગો ઓવાટા લેટિન નામ અને સ્પોન્જેલ સીડ્સ અંગ્રેજ નામથી ઓળખાતા આ ઇષદ્રગોળનાં બીજમાં મ્યુસિલેજ નામનું ચીકાણું દ્રવ્ય હોય છે. જેને કારણે અન્નનળીની રૂક્ષતા હૂર થાય છે. આ ચીકાણું પદાર્થેની કારણે જ આંતરડાના ચાંદા પર આવરાણ બની જાય છે જેથી તેના પર બીજા ક્ષોલ્ફ પદાર્થોની અસર થતી નથી. આ મ્યુસિલેજ નામનું દ્રવ્ય જાઈઓલ, અરેબિનોઝ અને ગૈલેક્ટરેનિક અમલથી બનેલું હોય છે. બીજ મજજામાં ૧૪.૭ ટકા લિનોલિક અમલ હોય છે. જેમાં કોલેસ્ટરોલ ઘટાડવાની ક્ષમતા રહેલી છે.

ઇષદ્રગોળમાં પાણી શોષવાની ગજબની ક્ષમતા છે. એક જ દાઢો ૩૩ ગાડો મોટો થઈ શકે છે. પાણી પીને અથવા તો પાણી શોષીને! હા, આથી જ કબજિયાતમાં તેને ઉપયોગ કરતા હોવ ત્યારે તેને લેતી વખતે